

## હલકા ધાન્ય સંશોધન કેન્દ્ર, મુવાલિયા ફાર્મ, દાહોદ હસ્તકની એગ્રી. પોલીક્લીનીક યોજના દ્વારા એક દિવસીય કેન્દ્રીય ખેડૂત તાલીમ કાર્યક્રમ યોજાયો

હલકા ધાન્ય સંશોધન કેન્દ્ર, આણંદ કૃષિ યુનિવર્સિટી, મુવાલિયા ફાર્મ, દાહોદ ખાતે ચાલતી યોજના “સ્ટ્રેન્ધનીંગ ઓફ એગ્રી. પોલીક્લીનીક ફોર ટ્રાયબલ ફાર્મર્સ એટ દાહોદ” દ્વારા તા.૩૧/૦૧/૨૦૧૮ ના રોજ “ અર્ધ શિયાળુ મગ (GAM-5) અને શાકભાજીના પાકોની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ તેમજ તેનું સંકલિત રોગ-જીવાત વ્યવસ્થાપણ” વિષય પર એક દિવસીય કેન્દ્રીય ખેડૂત તાલીમ કાર્યક્રમ યોજવામાં આવેલ હતો. કેન્દ્રીય તાલીમ કાર્યક્રમમાં તા.૩૧/૦૧/૨૦૧૮ ના રોજ દાહોદ જિલ્લાના ગામો મોટી ખરજ, ઉમડપુર, નગરાળા અને પાલ્લીના કુલ ૬૦ ખેડૂતભાઈઓ તેમજ બહેનો, કૃષિ વૈજ્ઞાનિકો અને કર્મચારીઓએ ભાગ લીધો હતો.

ડૉ. એસ. એ. ચૌહાણ (રિસર્ચ એસોસિએટ) એ પધારેલ ખેડૂતભાઈઓ, કૃષિ વૈજ્ઞાનિકો અને કર્મચારીઓનું શાબ્દિક સ્વાગત કર્યું. ત્યારબાદ ડૉ. વાય. બી ચૌહાણ (ઈ/યા યુનિટ વડા અને મદદનીશ સંશોધન વૈજ્ઞાનિક) દ્વારા એક દિવસીય તાલીમ વિશે ઉદ્દેશ્ય તેમજ ખેડૂતભાઈઓ, કૃષિ વૈજ્ઞાનિકો, કર્મચારીઓની ઉપસ્થિતિમાં દિવસ પ્રાગટ્ય કરી કાર્યક્રમનું ઉદ્દઘાટન કરવામાં આવેલ હતું. કાર્યક્રમના ઉદ્દઘાટન બાદ કૃષિ નિષ્ણાતો દ્વારા જુદા જુદા વિષયો પર પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા પ્રત્યક્ષ ખેડૂતોને માહિતી આપેલ.

ડૉ. એસ. એ. ચૌહાણ (રિસર્ચ એસોસિએટ) એ એગ્રી.પોલીક્લીનીક યોજનાકીય, અર્ધ શિયાળુ મગ (GAM-5) ની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ, જમીનનું પુથ્થકરણ અને મોબાઈલ એપ્લિકેશન “i-khedut” વિશે માર્ગદર્શન આપેલ. ત્યારબાદ તેમજ ડૉ. એમ. એમ. પંડ્યા (મદદનીશ સંશોધન વૈજ્ઞાનિક) એ આણંદ કૃષિ યુનિવર્સિટીમાંથી બહાર પાડેલ અર્ધ શિયાળુ મગ (GAM-5) અને શાકભાજીની જાતો વિશે ઉંડાણ માહિતી આપેલ, શ્રી એ. જી. પંપાણીયા (મદદનીશ સંશોધન વૈજ્ઞાનિક) એ શાકભાજીના પાકમાં નિકાશલક્ષી માવજતો અને નૂતન અભિગમો તેમજ ઓછા ખર્ચે વધુ ઉત્પાદન વિશે વિશે વિસ્તૃત માહિતી આપેલ. શ્રી એમ. પી. રામાણી (ખેતી અધિકારી) એ અર્ધ શિયાળુ મગ (GAM-5) અને શાકભાજી પાકોમાં આવતા નિંદણ અને તેનું સંકલિત નિંદણ નિયંત્રણ તેમજ આણંદ કૃષિ યુનિવર્સિટીમાંથી બહાર પાડેલ “અનુભવ જૈવિક પ્રવાહી”ની ઉપયોગીતા વિશે માર્ગદર્શન આપેલ. ડૉ. વાય. બી ચૌહાણ (ઈ/યા યુનિટ વડા અને મદદનીશ સંશોધન વૈજ્ઞાનિક) એ અર્ધ શિયાળુ મગ (GAM-5) અને શાકભાજી પાકોમાં આવતા રોગ અને જીવાતનું નિયંત્રણ અને કેન્દ્ર ખાતે ચાલતી શિક્ષણ, સંશોધન તેમજ વિસ્તરણની પ્રવૃત્તિઓ વિશે માહિતગાર કર્યાં.

ડૉ. વાય. બી. ચૌહાણ, ડૉ. એમ. એમ. પંડ્યા, ડૉ. એસ. એ. ચૌહાણ અને આરીફ શેખ એ પધારેલ ખેડૂતભાઈઓને હલકા ધાન્ય સંશોધન કેન્દ્ર હસ્તક આવેલ મ્યુઝીયમની મુલાકાત દરમ્યાન પ્રત્યક્ષ ચાર્ટ દ્વારા વિવિધ પાક વિશે માહિતી પૂર્ણ પાડેલ.

# ફોટોગ્રાફ



રજીસ્ટ્રેશન



શાબ્દિક સ્વાગત



દિપ પ્રાગટ્ય



“શાકભાજીના પાકમાં નિકાશલક્ષી માવજતો અને નૂતન અભિગમો” વિશે માર્ગદર્શન આપતા વૈજ્ઞાનિક શ્રી એ. જી. પંપાણીયા



“અર્ધ શિયાળુ મગ (GAM-5) અને શાકભાજી પાકોમાં સંકલિત નિદણ નિયંત્રણ તેમજ આણંદ કૃષિ યુનિવર્સિટીમાંથી બહારપાડેલ “અનુભવ જૈવિક પ્રવાહી”ની ઉપયોગીતા” વિશે માહિતી આપતા વૈજ્ઞાનિક શ્રી એમ. પી. રામાણી



“અર્ધ શિયાળુ મગ (GAM-5) અને શાકભાજી પાકોમાં આવતા રોગ અને જીવાતનું નિયંત્રણ અને કેન્દ્ર ખાતે ચાલતી શિક્ષણ, સંશોધન તેમજ વિસ્તરણની પ્રવૃત્તિઓ વિશે વ્યાખ્યાન આપતા વૈજ્ઞાનિક ડૉ. વાય. બી. ચૌહાણ



હલકા ધાન્ય સંશોધન કેન્દ્ર હસ્તક મ્યુઝીયમની મુલાકાત લેતા ખેડૂત ભાઈઓ અને બહેનો





હલકા ધાન્ય સંશોધન કેન્દ્ર મુલાકાત લેતા ખેડૂત ભાઈઓ અને બહેનો